

ત્વરિત જાહેરાત માટે

સિટી ઓફ બ્રમ્પટને નોર્થેમ્પટન પાર્કનું નામ બદલીને નોર્થરૂપ પાર્ક કર્યું

બ્રમ્પટન, ઓન્ટારિયો (25 એપ્રિલ 2022) – આજે, સિટી ઓફ બ્રમ્પટને નોર્થેમ્પટન પાર્કનું નામ સત્તાવાર રીતે બદલીને કોન્સ્ટેબલ જેફી નોર્થરૂપની યાદમાં અને તેમના માનમાં નોર્થરૂપ પાર્ક કર્યું, જેઓ 02 જુલાઈ 2021ના રોજ પોતાની ફરજ બજાવતી વખતે એક ઇમર્જન્સી કૉલનો જવાબ આપતી વખતે એક પોલીસ અધિકારી તરીકે 31 વર્ષ સુધી સેવા આપીને શહીદ થયા હતાં.

કોન્સ્ટેબલ નોર્થરૂપ એક બ્રમ્પટનવાસી હતાં. તેઓએ પોતાની કારકિર્દી 1989માં કોર્ટ સર્વિસમાં શરૂ કરી અને તેમણે 1999માં ટોરોન્ટો પોલીસ સર્વિસમાં કોન્સ્ટેબલ તરીકેના શપથ લીધા હતાં.

મેયર પેટ્રિક બ્રાઉને જણાવ્યું કે “ હું કોન્સ્ટેબલ નોર્થરૂપના પરિવાર અને મિત્રો સાથે મારી ઊંડી સંવેદના જાહેર કરું છું અને આ પાર્કના નામ બદલવાનો ભાગ બનવા માટે સન્માનિત છું જે તેમના ઉદાહરણરૂપ નેતૃત્વ અને બલિદાનની યાદ આપતી રહેશે. “મને આશા છે કે તેમનો પરિવાર અને મિત્રો આ પાર્કની મુલાકાત લેશે ત્યારે તેઓ એમને યાદ કરશે અને તેમની યાદને યીરંજીવ રાખશે.”

ટોરોન્ટો પોલીસના વડા જેમ્સ રેમરે જણાવ્યું કે “ટોરોન્ટો પોલીસ સર્વિસ વતી મારે સિટી ઓફ બ્રમ્પટનનો આભાર માનવો રહ્યો કે તેમને અમારા શહીદ અધિકારી ડિટેક્ટિવ કોન્સ્ટેબલ જેફી નોર્થરૂપને આ સન્માન આપ્યું”. “આ પાર્ક જે તેમનું નામ ધરાવશે તેનાથી તેમની યાદનું સન્માન થશે અને લોકોને જાહેર સેવાના મૂલ્યની યાદ અપાવશે. મને આશા છે કે તે તેમના પરિવાર અને મિત્રો તેમજ બ્રમ્પટનવાસીઓ માટે એક ગૌરવ અને આનંદના સ્થળ તરીકે પણ ગણાશે.”

કોન્સ્ટેબલ નોર્થરૂપ અને તેમના પત્ની માર્ગરિટ 20 કરતા વધુ વર્ષોથી બ્રમ્પટનના સમાજના સક્રિય સભ્યો રહ્યા છે જેઓ સ્કાઉટ્સ કેનેડા, બ્રમ્પટન લૂક્રોસ (Brampton lacrosse) તેમજ સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં સામેલ રહ્યા હતાં.

“શહીદ ડિટેક્ટિવ કોન્સ્ટેબલ જેફી નોર્થરૂપને પોતાના પરિવાર અને મિત્રો તેમજ પોતાના બ્રમ્પટનના સમુદાય માટે ખૂબ લાગણી હતી,” પીલ પ્રાદેશિક પોલીસના વડા નિશાન દુરાઈઅપ્પાએ જણાવ્યું હતું. “નોર્થરૂપ પાર્ક આપણા સમુદાયના લોકો માટે એક ખાસ જગ્યા બની રહેશે અને પીલ રિજનલ પોલીસ માટે કારણકે તે હંમેશા સ્મૃતિ કરાવશે કે ડિટેક્ટિવ કોન્સ્ટેબલ જેફી નોર્થરૂપ કોણ હતાં. તે સિટી ઓફ બ્રમ્પટન અને રિજન ઓફ પીલ પ્રતિ તેમની પ્રતિબદ્ધતાને તેમજ અન્ય લોકોની સેવામાં તેમના બલિદાનને સન્માનિત કરશે.

કોન્સ્ટેબલ નોર્થરૂપ તેમની સમાજ પ્રત્યેની અતુટ પ્રતિબદ્ધતા માટે યાદ કરવામાં આવશે, તેમનું પોતાની ટીમ પ્રતિ સમર્પણ અને એક પ્રેમાળ પતિ, પિતા અને પુત્ર તરીકે યાદ રખાશે. તેઓ તેમની પાછળ તેમના પત્ની માર્ગરેટ, ત્રણ બાળકો બ્રેનેન, સેમન્થા અને મિચેલ તેમજ માતા ડાયેનને છોડી ગયા છે.

આજની સવારનાઈવેન્ટની તસ્વીરો [અહીં Dropbox](#) પર ઉપલબ્ધ છે. ફોટાના ક્રેડિટ્સ સિટી ઓફ બ્રેમ્પટનને મળે છે.

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રેમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca